

રજૂ તારીખ : ૨૧-૦૮-૨૦૨૦
 દાખલ તારીખ : ૨૧-૦૮-૨૦૨૦
 જજમેન્ટ તારીખ : ૧૧-૧૧-૨૦૨૨
 અવધિ : વર્ષ માસ દિવસ

મહે. સુરતના સ્મોલકોઝ કોર્ટના એડીશનલ જજ સાહેબ સમક્ષ, સુરત.
એમએમસી.એસટી. નં.૧૫૯/૨૦૨૦
આંક :

- વાદી : (૧) મે.ગોલ્ડન ટેક્સટાઈલ્સ એક ભાગીદારી પેઢી,
 હે : ૨૩ થી ૨૬, નિરાંત ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, મોજે : પીપોદરા, તા.
 માંગરોળ, જી. સુરત.
- (૨) મનીષભાઈ ભાવેશભાઈ રામોલીયા તે,
 મે.ગોલ્ડન ટેક્સટાઈલ્સ ભાગીદારી પેઢીનાં ભાગીદાર અને વહીવટકર્તા,
 ઉ.આ.વ. : ૩૫, ધંધો : વેપાર,
 હે : ૨૩ થી ૨૬, નિરાંત ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, મોજે : પીપોદરા, તા.
 માંગરોળ, જી. સુરત.

વિરુદ્ધ

પ્રતિવાદી : રીકેશ અશોક જૈન તે અંજલી ફેબનાં પ્રોપરાઈટર,
 હે : દુકાન નં.૩૦૧૩, સાંઈ કૃપા માર્કેટ, રીંગરોડ, સુરત.

દાવો : રૂ.૧,૧૮,૪૧૦/- પુરા વ્યાજ સહિત વસુલાત માટેનો.

વાદી તરફે - વિ.વ.શ્રી એચ.એચ. સતાણી,

પ્રતિવાદી તરફે - એક તરફી

:: ચુકા દો ::

૧. વાદીએ હાલનો દાવો પ્રતિવાદી વિરુદ્ધ સી.પ્રો.કોડ ઓર્ડર-૩૭ ની જોગવાઈઓ અન્વયે નાણાં વસુલ મેળવવા માટે કરેલ છે. વાદીનાં કેસની ટુંકમાં હકિકત એવી છે કે,

વાદી નં.૧ એક ભાગીદારી પેઢી છે અને વાદી નં.૨ પેઢીનાં સક્રિય ભાગ ભજવતા ભાગીદાર છે અને વાદી ગોલ્ડન ટેક્ષટાઈલ્સનાં નામથી ગ્રે કાપડ બનાવી તેના વેચાણ તથા મેન્યુફેક્ચરનો ધંધો કરે છે. ભાગીદારી પેઢી વતી ખરીદ વેચાણ કરવા અને તેને આનુસંગિક કાર્યવાહી કરવા અંગેની ઓથોરીટી વાદીને લખી આપેલ છે. આ કામના પ્રતિવાદી અંજલી ફેબ્રિકા નામથી ગ્રે કાપડની ખરીદી તથા વેચાણ કરવાનો ધંધો કરે છે. વાદીને પ્રતિવાદીની ઓળખાણ તેમના કાપડ દલાલ મહેન્દ્રભાઈ વૈષ્ણવ મારફતે થયેલી. આ દલાલ પ્રતિવાદીના કાયમી કાપડ દલાલ છે. પ્રતિવાદીએ ગ્રે કાપડ ઉધારથી વેચાણ આપવા વાદીને જણાવેલ. જેથી ગ્રે કાપડનો ભાવતાલ નક્કી કરી તેમના ઓર્ડર મુજબ તા.૧૭/૧૧/૨૦૧૮ નાં રોજ ઈન્વોઈસ નં.૩૧૩ તથા ૩૧૪ થી કુલ રૂ.૧,૧૮,૪૧૦/- નું ગ્રે કાપડ વેપારી ધારા ધોરણ મુજબ પ્રતિવાદીને ઉધાર વેચાણથી આપેલજે માલ પ્રતિવાદીની સુચના મુજબ ડીલીવરી કરવામા આવેલ અને સદર માલ પ્રતિવાદીને મળી ગયા અંગેની તેમના જવાબદાર માણસોએ ચલણમાં સહી કરી આપેલી અને અસલ ચલણ પ્રતિવાદીને હાથોહાથ રૂબરૂમાં આપેલ. પ્રતિવાદીએ બીલની રકમ એક માસ માં ચુકવવાની હતી અને જો એક માસમાં ચુકતે નહિ કરે તો વાર્ષિક ૨૪% લેખે વ્યાજ ચુકવવાની શરત નક્કી થયેલ. પ્રતિવાદીએ ખરીદ કરેલ ગ્રે કાપડના માલની કાયદેસરની બાકી લેણી રકમ રૂ.૧,૧૮,૪૧૦/- સમયમર્યાદામાં વાદીને ચુકવી આપેલ નહિ જેથી મુદત વીત્યો વાદીએ અવાર નવાર ઉઘરાણી કરતાં પ્રતિવાદીએ બહાનાઓ બતાવી સમય પસાર કરેલ અને પેમેન્ટ ચુકવવામાં જેટલું મોડું થયેલ છે તેટલા સમયનું નુકશાન વળતર ચુકવી આપીશ તેમ જણાવેલ. ત્યારબાદ વાદીએ બાકી લેણી રકમની ઉઘરાણી કરતાં પ્રતિવાદીએ વાદીની બાકી લેણી રકમ ચુકવી આપેલ નહિ. જેથી વાદીએ પ્રતિવાદી પાસેથી બાકી લેણી રકમ વસુલ મેળવવા તેમના વકીલશ્રી મારફતે તા.૧૨/૬/૨૦૨૦ નાં રોજ નોટીસ મોકલાવેલ, જે નોટીસ પ્રતિવાદીને મળી જતાં નોટીસનો પ્રતિવાદીએ તેમના વકીલ મારફતે ઉડાવ જવાબ આપેલો. જેથી વાદીએ નોટીસના જવાબનો વળતો જવાબ અને ખુલાસો વાદીએ તા.૧૮/૬/૨૦૨૦ નાં રોજ તેમના વકીલશ્રી મારફતે પ્રતિવાદીને મોકલેલો, તેમ છતાં પ્રતિવાદીએ નોટીસ મુજબનું કોઈ વર્તન કરેલ નહિ. પ્રતિવાદીએ નોટીસના જવાબમાં ભાગીદારી પેઢીનાં ભાગીદાર નૈમીષભાઈ

વલ્લભભાઈ સોરઠીયાની હાજરીમાં બાકી બીલના નાણાની લેતીદેતી પૂર્ણ થઈ ગયેલ છે તેવો ખોટો આક્ષેપ કરેલો જેથી વાદીએ આ આક્ષેપ બાબતે ચોખવટ માટે તા.૮/૮/૨૦૨૦ નાં રોજ તેમના ભાગીદાર નૈમીષભાઈને નોટીસ આપેલી જે નોટીસ તેમને મળી જતાં તેઓએ નોટીસનો કોઈ ખુલાસો લેખિતમાં કરેલ નથી કે લેતીદેતી બાબતનાં કોઈ પુરાવા આપેલા નથી. જેથી વાદીએ હાલનો દાવો કરી પ્રતિવાદી પાસેથી માલનાં બીલની બાકી રકમ રૂ.૧,૧૮,૪૧૦/- પુરા દાવાની તારીખથી વસુલ ન આપે ત્યાં સુધી વાર્ષિક ૨૪% લેખે વ્યાજ સહિત તથા દાવાનો તમામ ખર્ચ સહિતની ભેગી રકમ પ્રતિવાદીની જાત તથા સ્થાવર કે જંગમ માલ મિલકતોને હરાજી કરાવી વસુલ મેળવી શકે તેવું વાદીનાં લાભમાં હુકમનામું કરી આપવા માટેની દાદ માંગેલ છે.

૨. આ કામના પ્રતિવાદીને સમન્સ ફોર એપીયરન્સની બજવાણી થતા પ્રતિવાદી તેઓના વકીલશ્રી મારફતે હાજર થઈને આંક-૬ થી વકીલપત્ર રજુ કરેલ છે ત્યારબાદ જવાબ રજુ કરવા માટે મુદત અરજી રજુ કરતાં, જે મંજૂર કરવામાં આવેલ, પરંતુ ત્યારબાદ પ્રતિવાદી તરફ જવાબ રજુ કરવામાં આવેલ ન હોય તેમનો જવાબ રજુ કરવાનો હકક બંધ કરવામાં આવેલ છે. ત્યારબાદ વાદીની ઉલટતપાસના તબક્કે પણ પ્રતિવાદી હાજર રહેલ ન હોય તેઓનો વાદીની ઉલટ તપાસનો હકક બંધ કરવામાં આવેલ અને ત્યારબાદ પ્રતિવાદી પુરાવા રજુ કરવાના તબક્કે તથા દલીલનાં તબક્કે પણ ગેરહાજર રહેલ હોય તેઓનો પુરાવાનો તથા દલીલનો હકક બંધ કરવામાં આવેલ છે.

૩. સદરહુ કામે નીચે મુજબના મુદ્દા ઘડવામાં આવેલ છે.

:: ISSUES ::

1. **Whether the plaintiff proves that, Rs.1,18,410/- is due from the defendant towards purchasing the good ?**
2. **Whether the plaintiff is entitled to get the interest ? If yes, at what rate ?**
3. **Whether the plaintiff is entitled to get relief as prayed for ?**
4. **What order and decree ?**

૪. સદરહુ કામે ઘડવામાં આવેલ મુદ્દાઓના નિર્ણય નીચે મુજબ છે.

૧. હકારમાં,
૨. અંશતઃ હકારમાં,
૩. અંશતઃ હકારમાં,
૪. આખરી હુકમ મુજબ

૫. ઉપરોક્ત મુદ્દાઓ સંદર્ભે વાદી ધ્વારા રજુ થયેલા પુરાવાઓ નીચે મુજબ છે.

૫.૧ –:: વાદી તરફે મૌખિક પુરાવા ::–

ક્રમ	આંક	સાહેદોના નામ
૧	૧૩	વાદી મનિષભાઈ ભાવેશભાઈ રામોલીયા ની સોગંદ ઉપર સરતપાસ.

–:: વાદી તરફે દસ્તાવેજી પુરાવા ::–

ક્રમ	આંક	દસ્તાવેજની વિગત
૧	૧૫	સપ્લીમેન્ટરી ભાગીદારી કરાર.
૨	૧૬	પ્રતિવાદીને બનાવી આપેલ બીલની રકમ ઈન્વોઈસ નં.૩૧૩ ની નકલ.
૩	૧૭	પ્રતિવાદીને બનાવી આપેલ બીલની રકમ ઈન્વોઈસ નં.૩૧૪ ની નકલ.
૪	૨૧	વાદી નં.૨ નાં આધારકાર્ડની નકલ.
૫	૨૨	વાદીના ઘંઘાના જીએસટી રજીસ્ટ્રેશન સર્ટીફિકેટની નકલ નંગ.૨
૬	૨૩	ભાગીદારી પેઢીનાં ઈન્કમટેક્સ રીટર્નની નકલ
૭	૨૪	પ્રતિવાદીને આપેલ ડીમાન્ડ નોટીસની નકલ
૮	૨૫	પ્રતિવાદીએ નોટીસનો જવાબ આપેલ તેની નકલ
૯	૨૬	નોટીસ જવાબનો વાદીએ વળતો જવાબ આપેલ તેની નકલ
૧૦	૨૭	નૈમીષભાઈને ખુલાસો કરવા આપેલ નોટીસ નકલ
૧૧	૨૮	એજન નોટીસ પોસ્ટ કર્યાની અસલ સફેદ પાવતી
૧૨	૨૯	નોટીસ નૈમીષભાઈને મળી ગયાનું પોસ્ટ ખાતાનું ઓનલાઈન સ્ટેટસ

ત્યારબાદ વાદી તરફે આંક-૧૯ થી કલોઝીંગ પુરસીસ રજુ કરવામાં આવેલ છે.

૫.૨ આ કામે પ્રતિવાદી તરફે કોઈ મૌખિક કે દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ નથી.

૬. સદરહુ મુદ્દાઓના નિર્ણયના કારણો નીચે મુજબ છે.

:: કારણો ::

૬.૧. મુદ્દા નં ૧ :-

વાદીનાં કેસની હકિકત તેમજ વાદીએ રજુ કરેલ આંક-૧૩ ની સોગંદ ઉપરની જુબાની ધ્યાને લેતાં, આ કામના વાદી ગોલ્ડન ટેક્સટાઈલ્સનાં નામથી ગ્રે કાપડ બનાવી તેના વેચાણ તથા મેન્યુફેક્ચરનો ધંધો કરે છે. અને આ કામના પ્રતિવાદી અંજલી ફેબ્રિકા નામથી ગ્રે કાપડની ખરીદી તથા વેચાણ કરવાનો ધંધો કરે છે. વાદીને પ્રતિવાદીની ઓળખાણ તેમના કાપડ દલાલ મહેન્દ્રભાઈ વૈષ્ણવ મારફતે થયેલી. આ દલાલ પ્રતિવાદીના કાયમી કાપડ દલાલ છે. પ્રતિવાદીએ ગ્રે કાપડ ઉધારથી વેચાણ આપવા વાદીને જણાવેલ. જેથી ગ્રે કાપડનો ભાવતાલ નક્કી કરી તેમના ઓર્ડર મુજબ તા.૧૭/૧૧/૨૦૧૮ નાં રોજ ઈન્વોઈસ નં.૩૧૩ તથા ૩૧૪ થી કુલ રૂ.૧,૧૮,૪૧૦/- નું ગ્રે કાપડ વેપારી ધારા ધોરણ મુજબ પ્રતિવાદીને ઉધાર વેચાણથી આપેલજે માલ પ્રતિવાદીની સુચના મુજબ ડીલીવરી કરવામાં આવેલ અને સદર માલ પ્રતિવાદીને મળી ગયા અંગેની તેમના જવાબદાર માણસોએ ચલણમાં સહી કરી આપેલી અને અસલ ચલણ પ્રતિવાદીને હાથોહાથ રૂબરૂમાં આપેલ. પ્રતિવાદીએ બીલની રકમ એક માસ માં ચુકવવાની હતી અને જો એક માસમાં ચુકવે નહિં કરે તો વાર્ષિક ૨૪% લેખે વ્યાજ ચુકવવાની શરત નક્કી થયેલ. પ્રતિવાદીએ ખરીદ કરેલ ગ્રે કાપડના માલની કાયદેસરની બાકી લેણી રકમ રૂ.૧,૧૮,૪૧૦/- સમય મર્યાદામાં વાદીને ચુકવી આપેલ નહિં જેથી મુદત વીત્યો વાદી એ અવાર નવાર ઉઘરાણી કરતાં પ્રતિવાદીએ બહાનાઓ બતાવી સમય પસાર કરેલ અને પેમેન્ટ ચુકવવામાં જેટલું મોડું થયેલ છે તેટલા સમયનું નુકશાન વળતર ચુકવી આપીશ તેમ જણાવેલ. ત્યારબાદ વાદીએ બાકી લેણી રકમની ઉઘરાણી કરતાં પ્રતિવાદીએ વાદીની બાકી લેણી રકમ

ચુકવી આપેલ નહિ. જેથી વાદીએ પ્રતિવાદી પાસેથી બાકી લેણી રકમ વસુલ મેળવવા તેમના વકીલશ્રી મારફતે તા.૧૨/૬/૨૦૨૦ નાં રોજ નોટીસ મોકલાવેલ, જે નોટીસ પ્રતિવાદીને મળી જતાં નોટીસનો પ્રતિવાદીએ તેમના વકીલ મારફતે ઉડાવ જવાબ આપેલો. જેથી વાદીએ નોટીસ ના જવાબનો વળતો જવાબ અને ખુલાસો તા.૧૮/૬/૨૦૨૦ નાં રોજ તેમના વકીલશ્રી મારફતે પ્રતિવાદીને મોકલેલો, તેમ છતાં પ્રતિવાદીએ નોટીસ મુજબનું વર્તન કરેલ નહિ. પ્રતિવાદી એ નોટીસના જવાબમાં ભાગીદારી પેઢીનાં ભાગીદાર નૈમીષભાઈ વલ્લભભાઈ સોરઠીયાની હાજરીમાં બાકી બીલના નાણાની લેતીદેતી પૂર્ણ થઈ ગયેલ છે તેવો ખોટો આક્ષેપ કરેલો જેથી વાદીએ આ આક્ષેપ બાબતે ચોખવટ માટે તા.૮/૮/૨૦૨૦ નાં રોજ તેમના ભાગીદાર નૈમીષભાઈને નોટીસ આપેલી જે નોટીસ તેમને મળી જતાં તેઓએ નોટીસનો કોઈ ખુલાસો લેખિતમાં કરેલ નથી કે લેતીદેતી બાબતનાં કોઈ પુરાવા આપેલા નથી. જેથી વાદીએ પ્રતિવાદી પાસેથી માલનાં બીલની બાકી રકમ રૂ.૧,૧૮,૪૧૦/- પુરા દાવાની તારીખથી વસુલ ન આપે ત્યાં સુધી વાર્ષિક ૨૪% લેખે વ્યાજ સહિત તથા દાવાનો તમામ ખર્ચ સહિતની ભેગી રકમ પ્રતિવાદીની જાત તથા સ્થાવર કે જંગમ માલ મિલકતોને હરાજી કરાવી વસુલ મેળવી શકે તેવું વાદીનાં લાભમાં હુકમનામું કરી આપવા માટે હાલનો દાવો દાખલ કરેલો છે.

સદરહુ કામે વાદી તરફે આંક-૧૫ થી સપ્લીમેન્ટરી ભાગીદારી કરાર રજુ કરેલ છે. આંક-૧૬ થી પ્રતિવાદીને બનાવી આપેલ બીલની રકમ ઈન્પોઈસ નં.૩૧૩ ની નકલ રજુ કરેલ છે. આંક-૧૭ થી પ્રતિવાદીને બનાવી આપેલ બીલની રકમ ઈન્પોઈસ નં.૩૧૪ ની નકલ રજુ કરેલ છે. આંક-૨૧ થી વાદી નં.૨ નાં આધારકાર્ડની નકલ રજુ કરેલ છે. આંક-૨૨ થી વાદીના ઇંધાના જીએસટી રજીસ્ટ્રેશન સર્ટીફિકેટની નકલ નં.૨ રજુ કરેલ છે. આંક-૨૩ થી ભાગીદારી પેઢીનાં ઈન્કમટેક્સ રીટર્નની નકલ રજુ કરેલ છે. આંક-૨૪ થી પ્રતિવાદીને આપેલ ડીમાન્ડ નોટીસની નકલ રજુ કરેલ છે. આંક-૨૫ થી પ્રતિવાદીએ નોટીસનો જવાબ આપેલ તેની નકલ રજુ કરેલ છે. આંક-૨૬ થી નોટીસ જવાબનો વાદીએ વળતો જવાબ આપેલ તેની નકલ રજુ કરેલ છે. આંક-૨૭ થી નૈમીષભાઈને ખુલાસો કરવા આપેલ નોટીસ નકલ રજુ કરેલ છે. આંક-૨૮ થી

એજન નોટીસ પોસ્ટ કર્યાની અસલ સફેદ પાવતી રજુ કરેલ છે. આંક-૨૯ થી નોટીસ નૈમીષભાઈને મળી ગયાનું પોસ્ટ ખાતાનું ઓનલાઈન સ્ટેટસ રજુ કરેલ છે.

આમ, આ કામે વાદીએ રજુ કરેલ તેમની સરતપાસના સોંગદનામામાં લખેલ હકીકતને વાદી તરફે રજુ કરેલ દસ્તાવેજી પુરાવાથી સમર્થન મળે છે. આ ઉપરાંત આ કામના પ્રતિવાદીને દાવા સમન્સ બજી ગયેલ હોવા છતાં હાજર રહેલ નથી કે વાદીની ઉલટતપાસ કરેલ નથી કે પ્રતિવાદી તરફે કોઈ પુરાવા રજુ થયેલ નથી એવા સંજોગોમા વાદીએ રજુ કરેલ પુરાવા ન માનવાને કોઈ કારણ રહેતું નથી. તેથી વાદીએ દાવામાં માંગણી કરેલ મુદ્દલ લેણી રકમ રૂ. ૧,૧૮,૪૧૦/- પ્રતિવાદી પાસેથી વસુલ મેળવવા વાદી હકકદાર થાય છે. જેથી મુદા નંબર-૧ નો જવાબ હકારમાં આપુ છું.

મુદા નં.૨ તથા ૩ :-

હવે આ કામે વાદી કંપની તરફે મુદ્દલ રકમ રૂ.૧,૧૮,૪૧૦/- ઉપર વાર્ષિક ૨૪ % લેખે વસુલ થતા સુધી ચઢતા વ્યાજ સહિતની માંગણી કરેલ છે. પરંતુ વાદી તરફે વાદી કંપની અને પ્રતિવાદીઓ વચ્ચે વ્યાજ મેળવવા બાબતેનો કોઈ કરાર થયેલ હોય તેવો કોઈ પુરાવો આ કામે રજુ કરેલ નથી. જેથી વાદીએ મુદ્દલ રકમ ઉપર ૨૪% વ્યાજની માંગણી કરેલ છે જે વધુ પડતી છે. પરંતુ કાયદાકીય જોગવાઈઓ ધ્યાને લેતાં વાદીને મુદ્દલ રકમ ઉપર ૮% વ્યાજ અપાવવું યોગ્ય અને ઉચિત જણાતું હોય, મુદા નં.૨ તથા મુદા નં.૩ નો નિર્ણય અંશતઃ હકારમાં આપી મુદા નં.૪ પરતવે ન્યાયના હિતમાં નીચે મુજબનો હુકમ કરું છું.

:: હુ ક મ ::

૧. વાદીનો સદરહુ દાવો આથી અંશતઃ મંજૂર કરવામાં આવે છે.
૨. વાદી પ્રતિવાદી પાસેથી રૂ.૧,૧૮,૪૧૦/- (અંકે રૂપિયા એક લાખ અઠાર હજાર ચારસોદસ પુરા) દાવા તારીખથી વસુલ થતા સુધી વાર્ષિક ૮% નાં વ્યાજ સહિત પ્રતિવાદીની જાત માલ મિલકતમાંથી વસુલ લેવા હકકદાર છે તેવું ઠરાવવામાં આવે છે.

૩. હુકમ મુજબ હુકમનામું દોરવું.

૪. ખર્ચ અંગે કોઈ હુકમ નથી.

હુકમ આજ તારીખ ૧૧ મી, માહે નવેમ્બર સને ૨૦૨૨ નાં રોજ ખુલ્લી અદાલતમાં જાહેર કર્યો.

તારીખ. : ૧૧/૧૧/૨૦૨૨

સ્થળ : સુરત.

(હિતેશકુમાર બુધાભાઈ શર્મા)

એડીશનલ જજ,

સ્મોલ કોઝ કોર્ટ, સુરત.

(GJ01147)